



دائرة التسجيل

مقررته رقم 11 لسنة 2023  
مقررته رقم 11 لسنة 2023

مقررته رقم 11 لسنة 2023

مقررته رقم 11 لسنة 2023

مقررته رقم 11 لسنة 2023

مقررته رقم 11 لسنة 2023

(IUL)RS/1/2023/215

11 لسنة 2023

مقررته رقم 11 لسنة 2023  
مقررته رقم 11 لسنة 2023





(ט) ספרים נחשבים לנכסיהם, ויש להם זכות קניין בהם. (פ) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

5. (א) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ב) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

6. (א) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ב) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

7. (א) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ב) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

(ג) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ד) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

(ה) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ו) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

8. (א) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ב) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

1. זכויות אחרות

2. זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

3. זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

4. זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

9. (א) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם. (ב) זכויות אחרות, כגון זכויות קניין, נחשבות לנכסיהם.

(ሀ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

(ለ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

10. የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

(ሀ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

(ለ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

11. የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

(ሀ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

12. የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

13. የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

14. የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

(ለ) የሚከተሉት ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-  
 ስራዎችን ለማጠናቀቅ ይገባል፡-

הוראת

15.

(א) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ב) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ג) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

חוקי המדינה והממשלה

16.

(א) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(א) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ב) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ג) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ד) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ה) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

חוקי המדינה והממשלה

18.

(א) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ב) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ג) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ד) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

חוקי המדינה והממשלה

19.

(א) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ב) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.

(ג) חוקי המדינה והממשלה יבוצעו על פי חוקי המדינה והממשלה.



25. የትምህርት ድጋፍ ለሀገር ውስጥ የሚገኙት ግንባታ ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

26. የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

(ሀ) የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

27. የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

(ሀ) የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

(ለ) የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

28. የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

(ሀ) የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።

(ለ) የግብር ስራዎች ለመጀመሩ ስለሚያስፈልግ የሚገኝ የግብር ክፍያ ለመክፈት ስለሚችሉ የሀገር ውስጥ አካላት በክፍያው ውስጥ ተገኝተዋል።







ትንሹ ገቢዎችን እና የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ 13-K/CIR/2018/01 ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 18 ላይ "ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት" ስምምነት ላይ ይገኛል።  
 ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት ላይ ይገኛል። - ቅጽ 14-PR ስምምነት ላይ ይገኛል።

(መ)  
 ትንሹ ገቢዎችን እና የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ 17.09 ላይ ይገኛል።  
 ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት ላይ ይገኛል። የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ፣  
 ቅጽ 7 (ገጽ) ስምምነት ላይ ይገኛል።  
 ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት ላይ ይገኛል። የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ፣  
 ቅጽ 13- K/CIR/2018/01 ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 19 ላይ "ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት" ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 14-PR ስምምነት ላይ ይገኛል። የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ፣  
 ስምምነት ላይ ይገኛል።

(ሀ) ትንሹ ገቢዎችን እና የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ 17.11 ላይ ይገኛል።  
 የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ፣ የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ፣  
 ቅጽ 13-K/CIR/2018/01 ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 21 ላይ "ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት" ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 21 ላይ "ዴሞክራሲያዊ የገቢ ማስጠበቅ ስምምነት" ስምምነት ላይ ይገኛል።  
 ቅጽ 16-PR ስምምነት ላይ ይገኛል።

የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ  
 የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ  
 የተጠቃሚውን ደንበኞችን ለማስጠበቅ

3- ክፍያ

የክፍያ / የዕቃ አገልግሎት / የክፍያ አገልግሎት

1. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።
- 1.2 የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ (የሥራ አፈጻጸም) ማድረግ።
2. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።
- 2.1 የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ 480000 BTU ን ማድረግ።
- Gree · Philips · Samsun · Panasonic · Hitachi
3. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።
4. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።
5. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።
6. የገንዘብ ገቢዎችን የሚመለከት ክፍያ ማድረግ።

سۆز ئىسكەن - 4

تەتقىقات نەتىجىسى

1 - تەتقىقات

سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى			
سۆز ئىسكەن	✓	سۆز ئىسكەن	#
سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى			
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى (2 تەتقىقات)	1.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	2.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى (سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى)	3.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى (سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى)	4.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى (سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى)	5.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 7 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	6.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	7.
سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى			
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 36 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	8.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 36 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	9.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 4 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	10.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 4 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	11.
سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى			
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	12.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى (سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى)	13.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	14.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	15.
سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى			
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 3 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	16.
		سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى 3 نۆمۇر 2023 سۆز ئىسكەن تەتقىقات نەتىجىسى	17.



3 - ጥያቄ

ጥያቄ 36 (ዘመናዊ ልምድ) ለግብይት ስራ ለማካተት የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ (2023 ዓ.ም. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ)						
የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ						
#	ደንብ ስም	ደንብ ቁጥር	ደንብ ዓይነት	ደንብ ተፈጻሚነት	ደንብ ስርዓት	ደንብ ስርዓት (ጥያቄ) (ጥያቄ ስርዓት)

ማሳሰቢያ:

1. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ.
2. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ.
3. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ.
4. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ.
5. የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ የሚያስፈልገውን ደንብ ለማረጋገጥ.

4 - תוצאות

דוח תוצאות לראשונה בדצמבר				
1. חשבון רווחים ופיקודים לראשונה בדצמבר				
#	ראשונה בס"ח	ראשונה בס"ח	ד"ש	חשבונית (פרו"ר) תוצאות ראשונה
1			31 דצמבר 2023	
			31 דצמבר 2023	
			30 ספטמבר 2023	
			תוצאה	
			הפסדים	
סך הכל				
2. תוצאות פיקודים 2 ראשונה א"ח ופיקודים שוטפים בס"ח				
				2022 ראשונה "Cash and cash equivalents"
				2021 ראשונה "Cash and cash equivalents"
			תוצאה	
			הפסדים	

הערות:

1. חשבון רווחים ופיקודים 3 פיקודים נאמדו כפיקודים ראשונים.
2. חשבון רווחים ופיקודים 2 פיקודים נאמדו כפיקודים ראשונים א"ח ופיקודים שוטפים בס"ח. **החשבונית הראשונה בדצמבר** **ראשונה בס"ח** **החשבונית הראשונה בדצמבר** (ס"ח): נאמדו כפיקודים ראשונים א"ח ופיקודים שוטפים בס"ח 1 סוף ראשונה ראשונה בס"ח.
3. תוצאות פיקודים 2 ראשונה א"ח ופיקודים שוטפים בס"ח (ראשונה בס"ח א"ח ופיקודים שוטפים בס"ח) נאמדו כפיקודים ראשונים א"ח ופיקודים שוטפים בס"ח.
4. הפיקודים הראשונים בס"ח נאמדו כפיקודים ראשונים א"ח ופיקודים שוטפים בס"ח 20 ראשונה בס"ח א"ח ופיקודים שוטפים בס"ח ראשונה בס"ח א"ח ופיקודים שוטפים בס"ח. הפיקודים הראשונים בס"ח נאמדו כפיקודים ראשונים א"ח ופיקודים שוטפים בס"ח 100 ראשונה בס"ח א"ח ופיקודים שוטפים בס"ח.



5 - جَ قَرَوَج

سَوَسْرَ اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر

جَ اِرَوَجَرَج اِرَوَجَرَج	جَ اِرَوَجَرَج قَرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر	جَ اِرَوَجَرَج قَرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر
70	70 ~ $\frac{\text{دَدَر اِرَوَجَرَج دَدَر}}{\text{دَدَر اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر}}$	اِرَوَجَرَج
10	10 x $\frac{\text{دَدَر اِرَوَجَرَج دَدَر}}{\text{دَدَر اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر}}$	دَدَر قَرَوَجَرَج دَدَر
10	10 ~ $\frac{\text{دَدَر اِرَوَجَرَج دَدَر}}{\text{دَدَر اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر}}$	دَدَر اِرَوَجَرَج
10	دَدَر اِرَوَجَرَج دَدَر سَوَسْرَ اِرَوَجَرَج دَدَر 2 جَ اِرَوَجَرَج	سَوَسْرَ اِرَوَجَرَج دَدَر
100		جَ قَرَوَج

ބަންދު ފޯމުގެ ސަލާސަތު

Form of Bid Security

WHEREAS, .....[name of Bidder] (hereinafter called “the Bidder”) has submitted his Bid for the Tender no.....issued by the Ministry of Education on .....for Supplying/Purchasing of ..... [name of Contract] (hereinafter called “the Bid”).

KNOW ALL PEOPLE by these presents that We ..... [name of Bank] of ..... [name of country] having our registered office at ..... (hereinafter called “the Bank”) are bound unto .....[name of Purchaser] (hereinafter called “the Purchaser”) in the sum of \*..... for which payment well and truly to be made to the said Purchaser, the Bank binds itself, its successors, and assigns by these presents.

SEALED with the Common Seal of the said Bank this .....day of .....20.....

THE CONDITIONS of this obligation are:

- (1) If, after Bid opening, the Bidder withdraws his Bid during the period of Bid validity specified in the Form of Bid;
- or
- (2) If the Bidder having been notified of the acceptance of his Bid by the Purchaser during the period of Bid validity:
  - (a) fails or refuses to execute the Form of Agreement in accordance with the Instructions to Bidders, if required; or
  - (b) fails or refuses to furnish the Performance Security, in accordance with the Instruction to Bidders; or
  - (c) does not accept the correction of the Bid Price pursuant to Clause 27,

\* The Bidder should insert the amount of the Guarantee in words and figures denominated in Maldivian Rufiyaa. This figure should be the same as shown in Clause 16.1 of the Instructions to Bidders.

we undertake to pay to the Purchaser up to the above amount upon receipt of his first written demand, without the Purchaser’s having to substantiate his demand, provided that in his demand the Purchaser will note that the amount claimed by him is due to him owing to the occurrence of one or any of the three conditions, specifying the occurred condition or conditions.

This Guarantee will remain in force up to and including the date ..... days after the deadline for submission of bids as such deadline is stated in the Instructions to Bidders or as it may be extended by the Purchaser, notice of which extension(s) to the Bank is hereby waived. Any demand in respect of this Guarantee should reach the Bank not later than the above date.

DATE..... SIGNATURE OF THE BANK

WITNESS ..... SEAL

[signature, name, and address]

ފޯމް ޖަނުވަރީ ފޯމް ޖަނުވަރީ ފޯމް

# Form of Performance Guarantee

To: .....  
[name & address of Purchaser]  
.....  
.....

WHEREAS ..... [name and address of Supplier] (hereinafter called “the Supplier”) has undertaken, in pursuance of Contract No. .... dated ..... to execute ..... [name of Contract and brief description of Works] (hereinafter called “the Contract”);

AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract;

AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;

NOW THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of \*..... [amount of Guarantee] ..... [amount in words], such sum being payable in the types and proportions of currencies in which the Contract Price is payable, and we undertake to pay you, upon your first written demand and without cavil or argument, any sum or sums within the limits of ..... [amount of Guarantee] as aforesaid without your needing to prove or to show grounds or reasons for your demand for the sum specified therein.

\*An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa.

We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand.

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.

SIGNATURE AND SEAL OF THE GUARANTOR .....

Name of Bank .....

Address .....

.....

.....

Date .....

ބަންޑު ދަންނަވާ ފޯމް ޖެނެރަލް ޕްރޮވިޑެންޝަލް ފޯމް

Form of Bank Guarantee for Advance Payment

To: .....  
[name & address of Purchaser]  
.....  
.....

[name of Contract]

Gentlemen:

In accordance with the provisions of the Conditions of Contract, of the above-mentioned Contract, .....  
.....[name and address of Supplier]  
(hereinafter called “the Supplier”) shall deposit with .....  
..... [name of Purchaser] a Bank Guarantee to guarantee his proper and faithful  
performance under the said Clause of the Contract in an amount of .....[amount of Guarantee]  
.....[amount in words].

We, the .....  
[Bank or Financial Institution], as instructed by the Supplier, agree unconditionally and irrevocably to  
guarantee as primary obligator and not as Surety merely, the payment to  
..... [name of Purchaser] on his first demand without whatsoever  
right of objection on our part and without his first claim to the Supplier, in the amount not exceeding  
\*..... [amount of Guarantee].....  
..... [amount in words].

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of Works  
to be performed there under or of any of the Contract documents which may be made between  
.....[name of Purchaser] and the Supplier, shall in  
any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change,  
addition, or modification.

\* An amount is to be inserted by the Bank or Financial Institution representing the amount of the  
Advance Payment, in Maldivian Rufiyaa.

This Guarantee shall remain valid and in full effect from the date of the advance payment under the Contract  
until .....[name of Purchaser] receives full repayment of the same  
amount from the Supplier.

Yours truly,  
SIGNATURE AND SEAL: .....  
NAME & ADDRESS OF BANK/INSTITUTION .....